



COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં મે 4 થી અમલી બનતા બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસમાં ફેરફારો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 29, 2020) – COVID-19 કટોકટી દરમિયાન બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સમુદાયને સુરક્ષિત રીતે સેવા આપતી હોવાની ખાતરી કરાવવા, સોમવાર, મે 4 થી અમલી બનતા, આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી બસ સર્વિસમાં નીચે જણાવ્યા પ્રમાણે ફેરફાર કરવામાં આવશે.

નીચે જણાવેલા રૂટ્સ પર વધારાની સર્વિસ અને વધારેલી ફ્રિક્વન્સી ફરી અમલી બનશે જેથી બ્રેમ્પટનમાં આરોગ્ય સંભાળ સગવડો અને રોજગાર ક્ષેત્રો સુધી પહોંચવામાં મદદ મળી રહે, અને અન્ય બ્રેમ્પટન સર્વિસીસ સુધી પહોંચ અને જોડાણો સુધારી શકાય. અમારી પાસે ઉપલબ્ધ સંસાધનો વડે આ સર્વિસીસ ટકાવી રાખવા શ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવશે.

- **511/511A ઝુમ સ્ટીલ્સ** – અઠવાડિક કામકાજના દિવસોમાં AM (સવારે 6 થી સવારના 9 વાગ્યા સુધી) અને PM (બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી) વ્યસ્ત સમયે ફ્રિક્વન્સી દર 20 મિનિટથી વધારીને દર 10 મિનિટનો કરવામાં આવ્યો છે
- **7/7A કેનેડી** – અઠવાડિક કામકાજના દિવસોમાં AM (સવારે 6 થી સવારના 9 વાગ્યા સુધી) અને PM (બપોરે 3 થી સાંજના 7 વાગ્યા સુધી) વ્યસ્ત સમયે ફ્રિક્વન્સી વધારીને દર 10 મિનિટનો કરવામાં આવ્યો છે
- **8 સેન્ટર** – શનિવારની સર્વિસ ઉમેરવામાં આવી
- **14/14A ટોરબ્રામ** – અઠવાડિક કામકાજના દિવસોમાં AM (સવારે 6 થી સવારના 9 વાગ્યા સુધી) અને PM (બપોરે 3 થી સાંજના 7 વાગ્યા સુધી) વ્યસ્ત સમયે ફ્રિક્વન્સી વધારીને દર 10 મિનિટની કરવામાં આવી
- **18 રિક્સી** – અઠવાડિક કામકાજના દિવસોમાં AM (સવારે 6 થી સવારના 9 વાગ્યા સુધી) અને PM (બપોરે 3 થી સાંજના 7 વાગ્યા સુધી) વ્યસ્ત સમયે ફ્રિક્વન્સી 15 મિનિટથી વધારીને દર સાત મિનિટે કરવામાં આવી
- **20/20A ઈસ્ટ ઈન્ડસ્ટ્રીયલ** – 20A ફરીથી શરૂ થશે - સોમવારથી શુક્રવાર સુધી
- **29 વિલિયમ્સ પાર્કવે** – દિવસના મધ્યાન સમયે (સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી) સર્વિસ સોમવારથી શનિવાર સુધી ઉમેરવામાં આવી, રવિવારે કોઈ સર્વિસ નહીં
- **31 મેક્વીન** – દિવસના મધ્યાન સમયે (સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી) સર્વિસ સોમવારથી શનિવાર સુધી ઉમેરવામાં આવી, રવિવારે કોઈ સર્વિસ નહીં
- **51 હીયરફોર્ડ** – દિવસના મધ્યાન સમયે (સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી) સર્વિસ સોમવારથી શનિવાર સુધી ઉમેરવામાં આવી, રવિવારે કોઈ સર્વિસ નહીં
- **52 મેક્મર્કી** – શનિવાર અને રવિવારની સર્વિસ ઉમેરવામાં આવી
- **60 મિસિસાગા** – દિવસના મધ્યાન સમયે (સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી) સર્વિસ સોમવારથી શુક્રવાર સુધી ઉમેરવામાં આવી

COVID-19 ને લીધે સીનિયર આઈડી અને વેટરન કાર્ડ્સ અત્યારે આપવામાં આવતા નથી. ગ્રાહકો આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી પોતાના એક્સ્પાયર્ડ કાર્ડ્સ વાપરવાનું ચાલુ રાખી શકે છે.

એક સ્મૃતિચિહ્ન (રિમાઈન્ડર) તરીકે, ટર્મિનલ્સ પર ગ્રાહક સેવા કાઉન્ટર્સ બંધ કરવામાં આવ્યા છે. મે 4 થી શરૂ કરીને, બ્રેમલી, બ્રેમ્પટન ગેટવે અને ડાઉનટાઉનમાં ટર્મિનલ બિલ્ડિંગના કામકાજના ક્લાકો બદલીને સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી કરવામાં આવ્યા છે.

હાલમાં સર્વિસ ચાલુ હોય તેવા રૂટ્સ અને તેના સમયપત્રકોની યાદી માટે વેબસાઈટ જુઓ, www.bramptontransit.com.

COVID-19 સુરક્ષા ઉપાયો

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવા, અને પોતાના હાથ અવારનવાર ધોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અઘતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/covid19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca